

O DIVINE and adorable Mother, with Thy help what is there that is impossible? The hour of realisations is near and Thou hast assured us of Thy aid that we may perform integrally the supreme Will.

Thou hast accepted us as fit intermediaries between the unthinkable realities and the relativities of the physical world, and Thy constant presence in our midst is a token of Thy active collaboration.

The Lord has willed and Thou dost execute:

A new Light shall break upon the earth.

A new world shall be born,

And the things that were promised shall be fulfilled.

હે મા ભગવતી! તારી સહાય હોય તો પછી શું અશક્ય રહે છે ? સાક્ષાત્કારની ઘડી પાસે આવી છે. તારી પરમ ઇચ્છાને અમે સંપૂર્ણપણે સાકાર કરીએ એ કાર્યમાં તારી સહાય આપવાની તેં ખાતરી આપી છે.

આ સ્થૂલ જગતની સાપેક્ષ વસ્તુઓ અને અચિંત્ય પરમ સત્ય એ બે વચ્ચે સુયોગ્ય સંયોગકાર તરીકે તેં અમને સ્વીકાર્યા છે. અમારી પાસે તારી હાજરી અખંડ રહે છે એ સૂચવે છે કે તું અમને સક્રિયપણે સહકાર આપી રહ્યો છે.

પ્રભુનો સંકલ્પ થયો છે, તું એને સાકાર કરે છે;

પૃથ્વી ઉપર એક નવીન પ્રકાશ પ્રકટશે.

એક નવી સૃષ્ટિ જન્મ પામશે.

અપાયેલાં વચનો પાર પડશે.

- શ્રી માતાજી

Prayers and Meditations : August 31, 1914* September 25, 1914*

પ્રાર્થનાઓ અને ધ્યાન : ૩૧ ઓગસ્ટ ૧૯૧૪* ૨૫ સપ્ટેમ્બર ૧૯૧૪*

From: Dakshina Karyalaya, Sri Aurobindo Ashram, Pondicherry-2. © 0413-2331470

રવાના: દક્ષિણા કાર્યાલય, શ્રી અરવિન્દ આશ્રમ, પોંડિચેરી-૨ © ૦૪૧૩-૨૩૩૧૪૭૦ • March 2021

<https://themothersprosperity.org>



Prosperity

શ્રી માતાજીની
સિદ્ધિ-રિદ્ધિ

2021

MARCH

૧ માર્ચ, ૨૦૨૧

– Towards A New World –

– એક નવી સૃષ્ટિ પ્રતિ –



Life is meant for
seeking the Divine
Life is realised when
finding the Divine.

Life is meant for seeking the Divine,
Life is realised when finding the Divine.

[February 1971: The Mother gave this special message for Prosperity]

જીવન છે પ્રભુને શોધવા માટે,

જીવનની સિદ્ધિ બને છે પ્રભુ મળે છે ત્યારે.

[ફેબ્રુઆરી ૧૯૭૧ : સિદ્ધિ-રિદ્ધિ માટે શ્રી માતાજીએ આપેલો ખાસ સંદેશ]

- શ્રી માતાજી

In this formidable disorder and terrible destruction can be seen a great working, a necessary toil preparing the earth for a new sowing which will rise in marvellous spikes of grain and give to the world the shining harvest of a new race. . . . The vision is clear and precise, the plan of Thy divine law so plainly traced that peace has come back and installed itself in the hearts of the workers. There are no more doubts and hesitations, no longer any anguish or impatience. There is only the grand straight line of the work eternally accomplishing itself in spite of all, against all, despite all contrary appearances and illusory detours. These physical personalities, moments unseizable in the infinite Becoming, know that they will have made humanity take one farther step, infallibly and without care for the inevitable results, whatever be the apparent momentary consequences: they unite themselves with Thee, O Master eternal, they unite themselves with Thee, O Mother universal, and in this double identity with That which is beyond and That which is all the manifestation they taste the infinite joy of the perfect certitude.

Peace, peace in all the world. . . .

- The Mother

આ પ્રચંડ ઊથલપાથલમાં, આ ભીષણ વિનાશની ભીતરમાં કોઈ મહાન કાર્ય થતું જોઈ શકાય છે, કોઈ નવાં બી વાવવા માટે પૃથ્વીને તૈયાર કરવા જરૂરી ખેડાણ થઈ રહ્યું છે. એમાંથી કોઈ અદ્ભુત કણવાળાં કણસલાં પાકશે, અને પૃથ્વીને નવી દેદીપ્યમાન માનવજાતિનો પાક આપશે ... વસ્તુ પૂરેપૂરી સ્પષ્ટ અને ચોક્કસરૂપે દેખાઈ રહી છે. તારા દિવ્ય તંત્રની રૂપરેખા ખૂબ સ્પષ્ટ બની ગઈ છે. અને કાર્યકર્તાઓનાં હૃદયમાં પાછી શાંતિ આવી છે અને સ્થિર થઈ છે. હવે શંકા કે સંકોચ રહ્યાં નથી. અધીરાઈ નથી, દુઃખ નથી. હવે કેવળ કાર્યની ભવ્ય સીધી રેખા જ નજર આગળ દેખાઈ રહી છે. ભલે પરિસ્થિતિ તદ્દન પ્રતિકૂળ દેખાતી હોય, માર્ગ આડોઅવળો ચાલ્યો જતો હોય. એવા-એવા સઘળા વિરોધો અને મિથ્યાભાસો હોવા છતાં, તેમની સામે થઈને પણ તારી શક્તિ સદાકાળથી પોતાનું કાર્ય પાર પાડ્યે જ જાય છે. આ સ્થૂલ દેહધારી વ્યક્તિઓ, જે અનંત આવિર્ભાવની પકડી ન શકાય તેવી ક્ષણો જેવી છે, જાણે છે કે તેમણે દેખાતાં ક્ષણિક પરિણામો સ્વીકારીને અને આવનારાં ચોક્કસ પરિણામોની પરવા કર્યા વિના, માનવજાતિને એક ડગલું નિશ્ચિતપણે આગળ લેવડાવ્યું હશે. હે શાશ્વત ગુરો, તારી સાથે તેઓ પોતાને એકરૂપ બનાવે છે, હે વિશ્વજનની, તારી સાથે તેઓ પોતાને એકરૂપ બનાવે છે, અને એ તત્ જ પર રહેલું છે અને એ તત્ જ સર્વ આવિર્ભાવમય પણ છે, એ બન્ને સાથેની દ્વિવિધ એકરૂપતામાં તેઓ સંપૂર્ણ નિશ્ચિતિનો અસીમ આનંદ અનુભવે છે.

શાંતિ, શાંતિ, અખિલ જગતમાં શાંતિ ...

- શ્રી માતાજી